

# ગુજરાત ની વિશેષતાઓ

બૃહદ્ મુંબઈ રાજ્યનું વિભાજન થતાં સને 1960 ના મેની પહેલી તારીખે ગુજરાતનું અલગ રાજ્ય અસ્તિત્વમાં આવ્યું.

ભારતનું સૌ પ્રથમ ફ્રી પોર્ટ (મુક્ત બંદર) કંડલા ગુજરાતમાં છે.

સુતરાઉ કાપડ સંશોધન માટેની એક માત્ર સંસ્થા 'અટિરા' ગુજરાતમાં છે.

ભારતના મીઠાના ઉદ્યોગમાં ગુજરાત મોખરે છે.

સિમેન્ટ ઉદ્યોગમાં ગુજરાત આગળ પડતું છે.

ભારતમાં સિંહ માત્ર ગુજરાતના ગિરનાં જંગલોમાં જ છે.

ચૂનાનો પથ્થર ગુજરાતમાં લગભગ દરેક સ્થળે મળી આવે છે.

આયુર્વેદિક યુનિવર્સિટી ભારતમાં ફક્ત ગુજરાત (જામનગર)માં છે.

બોકસાઇટનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત કરે છે.

સંખેડાનું લાકડા પરની કલાકારીગરીનું ખરાદી કામ પ્રખ્યાત છે.

ભારતના મુખ્ય બે અખાતો ખંભાતનો અખાત અને કચ્છનો અખાત ગુજરાતમાં છે.

હડપ્પા સંસ્કૃતિને મળતા અવશેષ અહીં લોથલ અને રંગપુરમાં મળે છે.

ગુજરાતી રાસ, ગરબા અને દુહાનું વિશિષ્ટ સાંસ્કૃતિક મહત્વ છે.

ભારતના ભાગ્યવિધાતા મહાત્મા ગાંધીની જન્મભૂમિ ગુજરાત છે.

'ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર' ખાતરનું મોટું કારખાનું ગુજરાતમાં છે.

ભારતમાં કોઈ પણ રાજ્ય કરતાં લાંબો દરિયાકિનારો ગુજરાતનો છે.

ભારતમાં કોઈ પણ રાજ્ય કરતાં વધારે બંદરો ગુજરાતમાં છે.

અંકલેશ્વરથી કચ્છ સુધીના પ્રદેશમાં કુદરતી તેલ-ગેસ ગુજરાતમાંથી મળ્યા છે.

ભારતમાં ચોક અને ચૂનાના પથ્થરનું ઉત્પાદન ફક્ત ગુજરાતમાં થાય છે.

સોડાએશના ભારતના ઉત્પાદનના 95 ટકા ગુજરાતમાં ઉત્પન્ન થાય છે.

મહાત્મા ગાંધી, સરદાર પટેલ, દયાનંદ સરસ્વતી જેવાં નરરત્નો ગુજરાતે આપ્યાં છે.

સહેલાણીઓના સ્વર્ગ સમું 'નળ સરોવર' દુનિયાભરનાં પક્ષીઓને આકર્ષે છે.

ખાદ્યતેલ (સીંગતેલ)ના ઉત્પાદનમાં ગુજરાત મોખરે છે.

કૃષ્ણની દ્વારકાનગરી અને આદ્ય શંકરાચાર્ય સ્થાપિત ચાર મહો પૈકીનો એક શારદાપીઠ ગુજરાતમાં દ્વારકા ખાતે છે.

સ્વામીનારાયણ ધર્મના સ્થાપક સ્વાહી સહજાનંદની કર્મભૂમિ ગુજરાત છે.  
વ્યાપારી અને વ્યવહારુ ગુજરાતી વિશ્વના દરેક દેશમાં મળે છે.  
ગતસૈકાઓમાં બનાવાયેલી પથ્થરની વાવનું પ્રમાણ ગુજરાતમાં વિશેષ છે.  
અમદાવાદમાં આવેલા 'ઝુલતા મિનારા' ઉત્કૃષ્ટ શિલ્પસ્થાપત્યનો નમૂનો છે.  
શત્રુંજય પર્વત પર અંદાજે 980 નાનાં મોટાં જૈન મંદિરો ધરાવતું સ્થળ પાલિતાણા ગુજરાતમાં છે.  
પાટણના પાદરે ખોદી કાઢવામાં આવેલી અખંડિત ઐતિહાસિક 'રાણકી વાવ' જોવા જેવી છે.